

**પાંડેસરા તથા ચોકબજાર પો.રે. ની ઘરહોડ ચોરીનો ભેદ ઉકેલતી  
પાંડેસરા પોલીસ, સુરત શહેર.**

પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંડેસરા ઉંન ખાતે આવેલ તસલીમનગર ઇન્દ્ર સોસાયટીના ખાતા નંબર ૦૨ ની ઓફીસમાં મકેશ્વરસીંગ ઉર્ફે મદન નામના ઇસમ દ્વારા સદર ખાતાના મેઇન દરવાખનુ લોક તોડી સદર ઓફીસમાં મુકેલ રોકડ રૂપીયા ૪,૫૦,૦૦૦/-ની મત્તાની ચોરી કરી નાશી ગયેલ હોય જે અનુસંધાને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એ-પાર્ટ ૧૧૨૧૦૦૪૫૨૧૧૭૮૭/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો નોંધવામાં આવેલ હોય જે અનુસંધાને સદર ગુનાના આરોપીને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ રહેલી પાંડેસરા પોલીસના સર્વેલન્સના પોલીસ માણસો દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ વર્ક આઉટ કરી મળેલ માહિતી મુજબ સદર આરોપી ગુનો આચરી તેઓના વતન (ઉત્તરપ્રદેશ) ખાતે નીકળી ગયેલ છે જે ખાતમી આધારે સદર ગુનામા નાસતો ફરતો આરોપી મકેશ્વરસિંગ ઉર્ફે મદન ઉર્ફે મુકેશ શંકરસિંગ ખતે કુર્મા ઉ.વ. ૪૫ રહે. તસલીમનગર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના ખાતા નંબર ૦૨ થી ૧૨ ની બાજુમાં આવેલ ચાયની લારી પર પાંડેસરા, સુરત મુળ રહે. રામપુર બંગરા ગામ સેવરિયા ગ્રામ પંચાયત થાના-ટરીયા સુબન-પોરટ. જિ.કુશીનગર યુ.પી. નાઓને યુપી ગોરખપુર ખાતેથી પકડી પાડી, ઉપરોક્ત ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે. સદર આરોપીની યુકિત પ્રચુકિતથી વધુ પુછપરછ કરતા તેમણે સને ૨૦૧૯ ના વર્ષમાં ચોક બજાર વેડ રોડ હરીઓમ મીલની પાછળ પટેલ ઇન્ડસ્ટ્રીયલ વિભાગ-૨ માં લુમ્સના કારખાનામાં રોકડ રકમ ૧,૯૦,૦૦૦/- ની મત્તાની ચોરી કરેલ હોવાનુ કબુલાત કરતો હોય જેથી નીચે મુજબના ઘરહોડ ચોરીના વણશોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવેલ છે.

ડિટેક થયેલ ગુનાઓ :- (૧) પાંડેસરા પો.રે. એ-પાર્ટ ૧૧૨૧૦૦૪૫૨૧૧૭૮૭/૨૧ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ મુજબ. (૨)ચોક બજાર પો. રે. ફરટ પાર્ટ ગુ.ર.નં.૩૪/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ  
આરોપીનો ગુનાઠીત ઇતિહાસ :- (૧) ચોક બજાર પોલીસ સ્ટેશન ફરટ પાર્ટ ગુ.ર.નં. ૧૬૪/૨૦૦૯ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ મુજબ  
(૨) કતારગામ પોલીસ સ્ટેશન ફરટ પાર્ટ ગુ.ર.નં. ૨૯/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૩૮૦, ૪૫૭, ૫૧૧ મુજબ.  
ગુનાની એમ.ઓ. :-મજકૂર આરોપી અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલમાં એકાદ બે દિવસ કામ કરી રાત્રીના સમયગાળા દરમ્યાન મોડાનો હાથદો ઉઠાવી ચોરી કરી પોતાના વતન ખાતે ચાલી જતો હોવાનુ જણાવેલ છે.